



- બાગડોગરા** : સવારે-બપોરે આગમન. અહીંથી ૧૭૦ કિ.મી. દુર - ૫ કલાક ભારતીય બોર્ડર (દિવસ-૧)
- (દિવસ-૨) કસ્ટમ્સ, દસ્તાવેજી ચેકીંગ, એન્ડ્રી પરમિશન વિધિ વિ. (૧ રાત્રિ) રોકાણ. (ડીનર) સવારે બ્રેકફાસ્ટ બાદ ભુતાનની રાજધાની થીમ્પુ (આશરે ૧૭૦ કિ.મી. - ૬ કલાક) જવા પ્રયાણ. પહાડી અને લીલીછમ વનરાજીઓવાળાં રસ્તાઓની મુસાફરી.
- થીમ્પુ** : (૨ રાત્રિ) (આશરે ૭૭૫૦ ફીટ) તાશીયો ઝોંગની મુલાકાત. રાત્રી રોકાણ. (બ્રેકફાસ્ટ-લંચ-ડિનર)
- (દિવસ-૩) સવારે બ્રેકફાસ્ટ બાદ મેમોરિયલ ચોરટેન, નેશનલ લાયબ્રેરી, સ્કુલ ઓફ આર્ટ-એન્ડ ક્રાફ્ટ, ટેક્સટાઈલ્સ હેરિટેજ મ્યુઝિયમ, રાત્રિ રોકાણ (બ્રેકફાસ્ટ-લંચ-ડિનર)
- (દિવસ-૪) આશરે બ્રેકફાસ્ટ બાદ પુનાખા (૮૦ કિ.મી. - ૩ કલાક) જવા પ્રયાણ. વાયા-ગોચુલા પાસ (આશરે ૧૦૩૦૦ ફીટ ઉંચાઈ) ચીમી લાખાંગની મુલાકાત.
- પુનાખા** : આશરે ૪૫૦૦ ફીટ ઉંચાઈએ ખળખળ વહેતી મોચ્ચુ નદીનાં કિનારે અનુપમ કુદરતી સૌંદર્ય ધરાવતું શહેર. પુનાખા ઝોંગ મુલાકાત. રાત્રિ રોકાણ (બ્રેકફાસ્ટ-લંચ-ડિનર)
- (૧ રાત્રિ) (દિવસ-૫) સવારે બ્રેકફાસ્ટ બાદ પારો (વાયા-થીમ્પુ) આશરે ૧૪૫ કિ.મી. - ૫ કલાકનો રસ્તો
- (૨ રાત્રિ) આશરે ૭૫૦૦ ફીટ ઉંચાઈએ સીમતોખામાં આવેલ બૌદ્ધ ડોરડેન (ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા) દર્શન, અત્યંત શુદ્ધ, નિર્મળજળ ધરાવતી પારોછુ સ્વિચ વિ. રાત્રિ રોકાણ (બ્રેકફાસ્ટ-લંચ-ડિનર)
- (દિવસ-૬) સવારે બ્રેકફાસ્ટ બાદ ૧૦૫૦૦ ફીટની ઉંચાઈએ આવેલ ૪-૫ કિ.મી. ટ્રેકિંગ-ઘોડા દ્વારા સ્વ.ખર્ચે ટાઈગર નેસ્ટની વિગ્રીટ તાકચાંગ-ડુંગચેલ ઝોંગ, ટાઈગર નેસ્ટની દુરથી ફોટોગ્રાફી, સિપુંગ ઝોંગ, નેશનલ મ્યુઝિયમ અને કીચુ લાખાંગ વિગ્રીટ પારો રાત્રિ રોકાણ (બ્રેકફાસ્ટ-લંચ-ડિનર)
- (દિવસ-૭) સવારે બ્રેકફાસ્ટ બાદ કુન્ટસોલિંગ (૧૭૫ કિ.મી. - ૫ કલાક) જવા પ્રયાણ, બાદમાં જયગાંવ (૧ રાત્રિ) (ભારતીય બોર્ડર)
- (દિવસ-૮) સવારે બ્રેકફાસ્ટ બાદ બાગડોગરા જવા રવાના. ૧૭૫ કિ.મી.-૫ કલાક બપોરના ૧૨ કલાકે બાગડોગરા એરપોર્ટ ડ્રોપીંગ. (બ્રેકફાસ્ટ) શુભ પ્રવાસ પૂર્ણ.



પેકેજ દર માં સમાવેશ થતાં ખર્ચાઓ : પોઈન્ટ ટુ પોઈન્ટ નોન-એસી વાહન, હોટલમાં ટવીન શેરીંગ નોન-એસી રૂમ, હોટલનાં રોકાણ દરમિયાન કાર્યક્રમ મુજબ હોટલમાંથી બનાવવામાં આવેલ બ્રેકફાસ્ટ તથા ડિનર રહેશે.

પેકેજ દરમાં સમાવેશ થતાં નથી તેવા ખર્ચાઓ : જોવાલાયક સ્થળોની પ્રવેશ ફી, ગાઈડ ફી, કુલી-મજૂરી, રોપ-વે, સ્પીડ બોટ, મીનરલ વોટર, ધોબી, ફોન, ટેક્સી, રૂમ સર્વિસ, પ્રવાસીને વીમો, લગોજનો વીમો, ઓકસીજન સીલીન્ડર, ઈન્ટરનેટ, WIFI, ટૂર મેનેજર, પેરાગ્લાઈડીંગ, બેડ ટી, બપોરની ચા, કોફી, મસાલા મિલ્ક, સવારી, ઘોડા સવારી, રીવર રાફ્ટીંગ, આઈસ સ્કી, વધારાનાં ભોજન નો ખર્ચ. ભુતાન ટુરીઝમ ટેક્સ, વિઝા ફી, પરમીટ ફી.

- ભુતાનમાં એન્ડ્રી પરમીટ માટે પ્રવાસીએ ફોટો આઈ.ટી. માટે માત્ર ઈલેક્ટ્રન કાર્ડ તથા પાસપોર્ટ (ઓરીજીનલ) તથા દરેકના ચાર પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે રાખવા. આ સિવાય કોઈ પણ આઈ.ડી.પુક માન્ય રહેશે નહીં તથા ૧૮ વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિએ સ્કુલ અથવા કોલેજનું ઓરીજીનલ ફોટાવાળું પ્રમાણપત્ર (અંગ્રેજીમાં) સાથે રાખવું.
- એન.આર.આઈ. નાગરિકતા ધરાવનાર પ્રવાસી માટે વિઝા ફી અલગથી રહેશે.
- ઉપરોક્ત હોટલ પેકેજમાં હોટલ તરફથી સાત બ્રેકફાસ્ટ - સાત ડિનર વ્યવસ્થા રહેશે.
- પોઈન્ટ ટુ પોઈન્ટ નોન એસી વાહન રહેશે. ટેમ્પો ટ્રાવેલર કે તેથી નાના વાહનમાં પ્રવાસ યોજવામાં આવશે તો રોટેશન મુજબ પ્રવાસીઓએ દરરોજ સીટો બદલવી પડશે.
- બાગડોગરાનું એર ફેરનું પેમેન્ટ અલગથી આપવાનું રહેશે.

SDF (Sustainable Development Fee) is included in the tour rates.

BT : બાગડોગરા - થીમ્પુ - પુનાખા - પારો - બાગડોગરા : દિવસ-૮ : બાગડોગરાથી બાગડોગરા : નોન એસી. વાહન

પ્રતિ વ્યક્તિ દર બે વ્યક્તિ વચ્ચે રૂમ	પ્રતિ વ્યક્તિ દર ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમ	પ્રતિ વ્યક્તિ દર ચાર વ્યક્તિ વચ્ચે રૂમ	બાબત (૫ થી ૮ વર્ષ) સીટ સાથે અને બેડ વગર	બાબત (૩ થી ૫ વર્ષ) સીટ અને બેડ વગર
₹.44975	₹.43975	₹.42975	₹.34975	₹.14975